

November 19, 2025

To,

BSE Limited

Dept. DSC_CRD

Phiroze Jeejeebhoy Towers,

Dalal Street

Mumbai 400 001

BSE Scrip Code: **506222**

National Stock Exchange of India Limited

Exchange Plaza,

Plot No. C/1, 'G' Block,

Bandra- Kurla Complex,

Bandra ('E')

Mumbai 400 051

NSE Symbol: **STYRENIX**

Subject: Intimation under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time - Newspaper Publication regarding Notice to Shareholders for special window for Re-lodgement of Transfer Requests of physical shares.

Ref.: SEBI Circular no. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated July 2, 2025.

Dear Sir / Madam,

Pursuant to Regulation 30 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and SEBI Circular no. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated July 2, 2025, please find enclosed herewith copies of newspaper advertisement published on November 19, 2025 in the below mentioned newspaper, informing about the opening of a special window for re-lodgement of transfer requests for physical shares, which were lodged prior to the deadline of April 01, 2019 and rejected / returned due to deficiencies in the documents.

1. Business Standard
2. Vadodara Samachar

The advertisement is also being made available on the Company's website at www.styrenix.com

Sharing this for your information and further dissemination on your websites please.

Thanking you,

Yours faithfully,

For **Styrenix Performance Materials Limited**

Chintan Doshi

Manager Legal & Company Secretary

Styrenix Performance Materials Limited
(formerly known as INEOS Styrolution India Ltd.)

Registered Office


9th Floor, 'SHIVA', Sarabhai Compound, Dr. Vikram
Sarabhai Marg, Vadiwadi, Vadodara - 390 023. Gujarat, India.

+91 265-2303201/02

secshare@styrenix.com

www.styrenix.com

CIN : L25200GJ1973PLC002436



ARB Surat Branch, Tulsi Market, Ring Road, Mandarwaja, Surat - 395002.
Ph. : 7016965509, 9176860781
Email : arb.surat@unionbankofindia.bank

POSSESSION NOTICE [Rule - 8(1)]

Whereas The undersigned being the Authorized Officer of the **Union Bank of India** under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand notice Dated **08/09/2025** calling upon the Borrower/ Guarantor /Mortgagor namely, **Mr. Bharatbhai Bhikhubhai Dhanani (Borrower), Mrs. Ashaben Bharatbhai Dhanani (Co-Borrower), Mr. Chandubhai Gopalbhai Sasani (Guarantor)** to repay the amount mentioned in the notice being **Rs. 26,48,568.25 (Rupees Twenty Six Lakh Forty Eight Thousand Five Hundred Sixty Eight and Paise Twenty Five Only)** with interest Within 60 Days From The Date Of Receipt Of The Said Notice.

The Borrower/Guarantor/Mortgagor Having Failed To Repay The Amount, Notice Is Hereby Given To The Borrower/Guarantor/Mortgagor And The Public In General That The Undersigned Has Taken **Symbolic Possession Of** The Property Described Herein Below In Exercise Of The Powers Conferred On Him Under Sub-Section (4) Of Section 13 of the Act Read With Rule 8 Of The Security Interest Enforcement Rules, 2002 On this the **17th day of November of the year 2025**.

The Borrower/Guarantor/Mortgagor In Particular And The Public In General Are Hereby Cautioned Not To Deal With The Properties And Any Dealings With The Properties Will Be Subject To The Charge Of **Union Bank Of India, ARB-Surat** For An Amount **Rs. 26,48,568.25 (Rupees Twenty Six Lakh Forty Eight Thousand Five Hundred Sixty Eight and Paise Twenty Five Only)** as on **31/08/2025** in the said account together with costs and interest as aforesaid.

The Borrowers/Guarantors/Mortgagors' attention is invited to the provision of sub section (8) of the section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.


Description of immovable property

All that piece and parcel of the immovable property bearing Plot No.75, admeasuring 98.70 Sq. Mtrs. with proportionate undivided inchoate share of Road, and COP 48.40 in Shiv Vatika Row House, with all appurtenances pertaining thereto on land bearing Revenue Survey No 60 Block No.54 lying being and situated at Village: Mankana, Sub-District : Kamrej, District : Surat. Owned By : Mr. Bharatbhai Bhikabhai Dhanani.

Date : 17/11/2025
Place : Mankana, Kamrej, Surat

Authorised Officer
Union Bank of India

Publication Date : 18-11-2025 News Paper : Business Standard (Ahmedabad Edition)



ARB Surat Branch, Tulsi Market, Ring Road, Mandarwaja, Surat - 395002.
Ph. : 7016965509, 9176860781
Email : arb.surat@unionbankofindia.bank

POSSESSION NOTICE [Rule - 8(1)]

Whereas The undersigned being the Authorized Officer of the **Union Bank of India** under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand notice Dated **08/09/2025** calling upon the Borrower/ Guarantor /Mortgagor namely, **M/s. Kuber Enterprise Proprietor - Mr. Chirantar Shantibhai Jadhav (Borrower), Mr. Chirantar Shantibhai Jadhav (Proprietor of M/s. Kuber Enterprise)(Borrower), Mr. Chirag Rameshbhai Patel (Guarantor), Mr. Vivek Rameshbhai Patel (Guarantor)** to repay the amount mentioned in the notice being **Rs. 1,41,04,259.28 (Rupees One Crore Forty One Lakh Four Thousand Two Hundred Fifty Nine and Twenty Eight Only)** with interest Within 60 Days From The Date Of Receipt Of The Said Notice.

The Borrower/Guarantor/Mortgagor Having Failed To Repay The Amount, Notice Is Hereby Given To The Borrower/Guarantor/Mortgagor And The Public In General That The Undersigned Has Taken **Symbolic Possession Of** The Property Described Herein Below In Exercise Of The Powers Conferred On Him Under Sub-Section (4) Of Section 13 of the Act Read With Rule 8 Of The Security Interest Enforcement Rules, 2002 On this the **17th day of November of the year 2025**.

The Borrower/Guarantor/Mortgagor In Particular And The Public In General Are Hereby Cautioned Not To Deal With The Properties And Any Dealings With The Properties Will Be Subject To The Charge Of **Union Bank Of India, ARB-Surat** For An Amount **Rs. 1,41,04,259.28 (Rupees One Crore Forty One Lakh Four Thousand Two Hundred Fifty Nine and Twenty Eight Only)** as on **31/08/2025** in the said account together with costs and interest as aforesaid.

The Borrowers/Guarantors/Mortgagors' attention is invited to the provision of sub section (8) of the section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.


Description of immovable property

Office No: S-486, 4th Floor, Silver Plaza Complex, Belgium Square, admeasuring 458.00 sq. ft. (Carpet Area 311.44 Sq. Ft.) situated at Ward No. 7, City Survey Nordh No. 4824-A, Rampura, Taluka- Choraysi, Surat, Boundary : West : Entry, Passage & Office No. S-486, East : Ring Road, North : Lift, South : Japan Market. Owned By : Mr. Chirantar Shantibhai Jadhav.

Date : 17/11/2025 | Place : Rampura, Surat

Authorised Officer
Union Bank of India

Publication Date : 18-11-2025 News Paper : Business Standard (Ahmedabad Edition)



DEBTS RECOVERY TRIBUNAL-II,
Ministry of Finance, Government of India
3rd Floor, Bhikhubhai Chambers, Near Kochrab Ashram, Paldi, Ahmedabad, Gujarat

FORM No.22 (Earlier 62) (Regulation 36 & 37 of DRT Regulations, 2015) [See Rule 52 (1) (2) of the Second Schedule to the Income-tax Act, 1961] Read With The Recovery of Debts Due to Bank and Financial Institutions Act, 1993

E-AUCTION/SALE NOTICE
THROUGH REGD. AD / DASTI / AFFIKATION / BEAT OF DRUM / PUBLICATION

RP/RC No.	38/2008	OA No.	200/2004
Certificate Holder Bank	Punjab National Bank		
	Vs.		
Certificate Debtors	M/s. Ekta Petroleum & Ors.		

To,
C.D.No.1, M/s. Ekta Petroleum, Proprietorship concern, having its place of business at National Highway No.8, Nabipur, Ta. Bharuch, Dist. Bharuch, owned by **Shrimati Madhuben Jayantilal Makwana**, residing at E-1/953, Kubharia Dhorav, Limdi Chowk, Bharuch.
C.D.No.2 Shri. Jayantilal Kanjibhai Makwana, E-1/953, Kubharia Dhorav, Limdi Chowk, Bharuch.
C.D.No.3 Shri. Somechand Kanjibhai Makwana (Deceased)
3.1:- Nirmalaben Somchand Makwana W/o Shri.Somechand Kanjibhai Makwana Residing at E-1/952, Kubharia Dhorav, Limdi Chowk, Bharuch.
3.2:- Rakesh Somchand Makwana S/o Shri.Somechand Kanjibhai Makwana E-1/952, Kubharia Dhorav, Limdi Chowk, Bharuch.
C.D.No.4, Shri. Ratilal Kanjibhai Makwana (Deceased)
4.1:- Rajesh Ratilal Makwana S/o Shri. Ratilal Kanjibhai Makwana E-1/952, Kubharia Dhorav, Limdi Chowk, Bharuch.

The aforesaid CDs No. 1 to 2, 3, 1 to 3, 2 & 4.1 have failed to pay the outstanding dues of **Rs. 29,44,259.13/- (Rupees Twenty nine lacs forty four thousand two hundred fifty nine and thirteen paise only)-** as on 06/09/2004 including interest in terms of judgment and decree dated 02/05/2008 passed in O.A.No.200/2004 (Less recovery, if any) as per my order dated 12.11.2025 the under mentioned property (s) will be sold by public e-auction in the aforementioned matter. The auction sale will be held through "online e-auction" <https://baanet.com>.

Lot No	Description of the Property	Reserve Price (Rounded off)	EMD 10% of (Rounded off)
1.	Property being at ward No.05 city survey No.2210 Municipal ward E-1/952 Khumbharia Dholav, Nr.Limdi, Chowk, Ta. And Dist. Bharuch. On its East: City Survey No.2211, On its West:Public Road, On its North : Public road, On its South -Public Road.	Rs. 14.75 Lakhs	Rs. 01.48 Lakhs
2.	Property being at ward No.05 city survey No.2211 Municipal ward E-1/953 Khumbharia Dholav, Nr.Limdi, Chowk, Ta. And Dist. Bharuch. On its East: City Survey No.2212, On its West:City Survey No.2210, On its North : Public road, On its South-Public Road.	Rs. 09.20 Lakhs	Rs. 00.92 Lakhs
3.	Property being at ward No.05 city survey No.2212 Municipal ward E-1/954 Khumbharia Dholav, Nr.Limdi Chowk, Ta. And Dist. Bharuch. On its East: City Survey No.2213, On its West:City Survey No.2211, On its North : Public road, On its South-Public Road.	Rs. 09.20 Lakhs	Rs. 00.92 Lakhs

Note: The EMD shall be deposited in baanet wallet through E-auction website i.e. <https://baanet.com>. The highest bidder shall have to deposit 25% of his final bid amount after adjustment of EMD already paid in the baanet wallet by immediate next bank working day through RTGS/NEFT as per the details as under:-

Beneficiary Bank Name :	Punjab National Bank
Beneficiary Bank Address :	Sundry/NPA/SARFAESI/Auction related
Account Name :	SUBSIDY INWAED REMIT-NEFT/RTGS ACCOUNT
Beneficiary Account No. :	832300317118A
IFSC Code :	PUN0832300
Branch :	ARMB, Surat.

1) The bid increase amount will be Rs. 10,000/-for lot No.1 to 3.
2)Prospective bidders may avail online training from service provider PSB Alliance (**BAANKNET Auction Portal**) (Tel: Helpline No. +91-8281220220 and Mr. Kashyap Patel (Mobile No.9327493060) Helpline E-mail ID: Support.BAANKNET@psballiance.com and for any property related queries may contact **Mr.Ashwin Singh Rathore**(Mob.No. 9729225088).
3)Prospective bidders are advised to visit website <https://baanet.com> for detailed terms & conditions and procedure of sale before submitting their bids.
4) The prospective bidders are advised to adhere payment schedule of 25% (minus EMD) immediately after fall of hammer/close of auction and 75% within 15 days from the date of auction and if 15th day is Sunday or other Holiday, then on immediate next bank working day. No request for extension will be entertained.
5) The properties are being put to sale on "as is where is", "as is what is" and "as is whatever" basis and prospective buyers are advised to carry out due diligence properly.
6) Schedule of auction is as under:-

SCHEDULE OF AUCTION	
1	Inspection of Property 19.12.2025 Between 11.00 am to 02.00 pm.
2	Last date of receiving bids along with earnest money and uploading documents including proof of payment made. 20.01.2026 upto 05.00 pm
3	e-auction 21.01.2026 Between 12.00 pm to 01.00 pm (with auto extension clause of 03 minutes, till E-Auction ends)

(RAJESH KUMAR SHARMA)
RECOVERY OFFICER - II
DEBTS RECOVERY TRIBUNAL -II
AHMEDABAD

PUBLIC NOTICE

NOTICE is hereby given that the certificate[s] for the under mentioned securities of the Company has been lost/misplaced and the holder[s] of the said securities / applicant[s] has applied to the Company to issue duplicate certificate[s].

Name of the holder	Name of Company	Folio No[s]	Face Value	Certificate Number[s]	Distinctive Number[s]	No of Shares
PRAVINABEN BHUPENDRABHAI JOSHI	DALMIA BHARAT LTD	DBL0227976	2	227976	192333120-192335909	2790
	DALMIA BHARAT SUGAR AND INDUSTRIES LTD	DCB016618	10	18096	1713308 - 1713357	50
		DCB016618	10	18880	1894950 - 1894959	10
		DCB016618	10	21402	2578318 - 2578332	15
		DCB016618	10	43332	1359854 - 1359863	10
		DCB016618	10	44021	1397382 - 1397401	20
		DCB016618	10	61962	3300067 - 3300101	35
		DCB016618	10	62338	3325389 - 3325458	70
		DCB016618	10	93877	6018115 - 6018137	23
		DCB016618	10	94139	6034999 - 6035044	46

The Public are hereby cautioned against purchasing or dealing in any way with the above referred share certificate[s].


Any person who has any claim in respect of the said share certificate[s] should lodge such claim with the Company or its Registrar and Transfer Agents: KFin Technologies Ltd, Selenium, Tower B, Plot 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Serilingampally Mandal, Hyderabad, Telangana, 500032. within 15 days of publication of this notice after which no claim will be entertained and

The Company shall proceed to issue with the Duplicate Share Certificate[s].

Place: Jamnagar

Date: 19/11/2025

Name of the holder:
PRAVINABEN BHUPENDRABHAI JOSHI



HINDUJA HOUSING FINANCE

Corporate Office: No. 167-169, 2nd Floor, Anna Salai, Saidapet, Chennai-600015
Branch Office: 3rd, Floor, IFFCO Bhavan, B/h. Maruti Complex, B/h. Pintloo Garment, Nr. Shivranganji Cross Road, Satellite, Ahmedabad-380015
Saurabhkumar Naiti Mo.879029384, Vikas Savariya Mo. 794982904, Hitesh Kumar Patel Mo.7048336601, Sushil Chaudhary Mo. 8118818160, Nitiin Samudre M. 8128310678, Trishul Patel Mo. 9664692923, Shivam Mishra M. 9033015277 E-mail auction@hindujahousingfinance.com

Physical Possession Notice - As per Appendix IV

Whereas, The undersigned being the Authorized Officer of Hinduja Housing Finance Limited (HHFL) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued the Demand Notice under section 13(2) calling upon the borrowers to repay the amount mentioned in the notice alongwith further charges, interest etc. within 60 days from the date of the said notice. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the said Act read with Rule 8 of the Security interest Enforcement Rules, 2002.

Sr. No.	Name of the Borrower(s) / Co-Borrower(s) / Guarantor(s)	Demand Notice Date and Amount Loan Account No.	Date & Type of Possession	Schedule of the Property
1	Borrower: (1) Mr. Gabharubhai Khavad Co-borrower : (2) Mrs. Ayabben Khavad	Dt. 27/02/2025 & Rs. 7,67,176 & A/C No. GJ/SRN/SDNI/A000000296	16-11-2025 Physical Possession	All part and parcel of non-agriculture Immovable Residential Plot on Khintla Aakarni Patrak No.38, Property No.38, Land admeasuring 278.70 Sq.mts,

situated At: Khintla, Taluka: Sayla, District: Surendranagar, Gujarat 363440, currently owned and possessed by Khavad Aaibaben Gabharubhai with boundaries as under; Boundaries:- North: Bajar-Road, South: Laghrabhai Bhimbahai, East: Plot of Limbabbhai Bhudarbhai, West: House of Muna Bhura.

THE PHYSICAL POSSESSION HAS BEEN TAKEN AS PAR COURT ORDER DATED 07.10.2025, ISSUED BY THE ADDITIONAL CHIEF JUDICIAL MAGISTRATE, LIMBADI.

2	Borrower: (1) Mr. Lakhmashibhai Sambad Co-borrower : (2) Mrs. Radhaben Sambad	Dt. 27/02/2025 & Rs. 10,22,910 & A/C No. GJ/SRN/SDNI/A000000214	16-11-2025 Physical Possession	All part and parcel of non-agriculture Immovable Residential Plot on Noli Aakarni Patrak Property No.109/123, Land admeasuring 167.22 Sq.mts,
---	--	--	---------------------------------------	---

situated At: Noli, Taluka: Sayla, District: Surendranagar, Gujarat -363430, currently owned and possessed by Sambad Radhaben Lakhmashibhai with boundaries as under; North: khimbabhai Devayatbhai, South: Road, East: Old Police Station, West: House of Sondabbhai Ghughabhai.

THE PHYSICAL POSSESSION HAS BEEN TAKEN AS PAR COURT ORDER DATED 07.10.2025, ISSUED BY THE ADDITIONAL CHIEF JUDICIAL MAGISTRATE, LIMBADI.

3	Borrower: Mr. Pareshkumar Pandiya Co-Borrower: Mrs. Sayhodha Kumari	Dt. 27/02/2025 Rs. 9,97,808/- & A/C No. GJ/VPI/VAPI/A000000408	16-11-2025 Physical Possession	ALL THE PIECE AND PARCEL of the immovable property bearing Flat No. 314, admeasuring about 675.00 Sq. Fts., equivalent to 62.70 Sq. Mtrs., super built up
---	--	---	---------------------------------------	---

area, Situated on the Third Floor of the "C" building known as "KARMBHAI COMPLEX" Constructed on the N.A. land bearing Survey No. 280/2, admeasuring about 4611.00 Sq. Mtrs., Situated at Village- Chanod, Taluka- Vapi, District- Valsad, Gujarat State Currently owned and possessed by SHAILESH MAHAVERE JAISWAL and to be purchased by PARESH KUMAR SIRESH PANDIYA. And is bounded as under:- East-By Flat No. 301, West-By Flat No. 313, North-By D-Building, South-By Flat No. 306.

THE PHYSICAL POSSESSION HAS BEEN TAKEN AS PAR COURT ORDER DATED 03.10.2025, ISSUED BY THE ADDITIONAL CHIEF JUDICIAL MAGISTRATE, VAPI.

4	Borrower : Mr. Khantlikumar Patel Co-Borrower : Mrs. Falguniben Patel	Dt. 19/12/2024 & Rs.18,29,597/- & A/C No. GJ/AND/ANAD/A000000072	18-11-2025 Physical Possession	An Immovable Residential Premises being Tower A-Square1st FloorFlat No. A-103, Super Built up area 83.87Sq. Mt., Undivided area26.18 Sq. Mt.,
---	--	---	---------------------------------------	---

Municipality Property No.12/19/143/9/44/A03, Situated "Govardhan Hills" T. P.No.7, F. P. No.145 Paiki admeasuring area 1678.00 Sq. Mt., of R.S. No. 613/1 Village Anand, Ta. & Dist. Anand with Boundaries as under: East: Flat No. A/104, West: Final Plot No. 146, North: Final Plot No. 187, South: Flat No. A/102.

THE PHYSICAL POSSESSION HAS BEEN TAKEN AS PAR COURT ORDER DATED 20.08.2025, ISSUED BY THE 4TH ADDL. CHIEF JUDICIAL MAGISTRATE, ANAND.

Place : Gujarat

Date : 19.11.2025

Authorized officer

For, Hinduja Housing Finance Limited

FORM NO. URC-2

Advertisement giving notice about registration under Part I of Chapter XXI of the Act [Pursuant to section 374 (b) of the Companies Act, 2013 and rule 4(1) of the Companies (Authorised to Register) Rules, 2014]

1. Notice is hereby given that in pursuance of sub-section (2) of section 366 of the Companies Act, 2013, an application is proposed to be made after fifteen days hereof but before the expiry of thirty days hereinafter to the Registrar at AHMEDABAD that **ECOMOBILITY INNOVATIONS LLP**, a Limited liability partnership may be registered under Part I of Chapter XXI of the Companies Act, 2013, as a company limited by shares.

2. The principal objects of the company are as follows:

i) To carry on the business of manufacture, fabricate and assemble, buy, sell, import, export, distribute, and deal in automobile parts of all kinds and descriptions, automotive and other gears, transmission and other axles, universal joints, springs, leaves, head lamps, sealed beams, induction hardened pins, axles, alloy springs, accessories and fittings of all kinds and to act as brokers and marketing agents for aforesaid items.

ii) To carry on the business of buying, selling, dealing in, automobiles, motorcars, lorries, buses, vans, motorcycles, bicycle, electric cycle, motor, scooters, carriages, and vehicles suitable for propulsion on land, sea, or in the air or amphibious vehicles, and vehicles of all descriptions, whether propelled or in any combination thereof and vehicles of all descriptions, whether propelled or assisted by means of petrol, diesel, spirit, steam, gas, electrical, animal or other power, and of internal combustion and other engines, chassis-bodies and other components, parts and accessories and all machinery, implements, utensils, appliances, apparatus, lubricants, solutions enamels and all things capable of being used for, in or in connection with maintenance, and working of motors.

iii) To carry on all or any of the businesses of importers and exporters, buyers, sellers, stockists, suppliers, agents and distributors, wholesale and retail dealers, repairers, hirers, stores of and workers in motor cars, motor buses, omnibuses, motor lorries, trailers, buses, motor trucks, motorcycles, bicycle, electric cycle, scooters, jeeps, trolleys, trailers, buses, motor vans, vehicles, commercial vehicles, velocipedes, whether propelled or assisted by means of petrol, diesel oil, powering oil, spirit, gas, vapour, electricity, battery, solar energy, animal, manual labour or any other powers whatsoever and to own, lease, manage, carry on and run the business of garage proprietors, workshop owners and of a service station for motor vehicles of all kinds, servicing, repairing and maintenance of vehicles of every description.

iv) To operate motor transport of all kinds, including the leasing, hiring or letting out of cars, trucks, tractors, and breakdown vehicles.

v) To undertake the safe keeping, cleaning, repairing, painting, furnishing, body building, refueling and servicing of motor vehicles of all kinds.

vi) To manufacture, produce, buy, sell all kind of spare parts, components, accessories, fittings, furnishings, engines, chassis, bodies, tools and implements, in connection with business as mentioned throughout this deed, oil, lubricants and petroleum spare parts, accessories, radios, cassette players, rubber and electrical goods and to carry on the business of body builders of motor vehicles and trucks.

vii) To carry on the business of manufacture including production and processing and fabrication and assembling, repairing, alteration, buying, importing, marketing, selling and exporting and otherwise dealing in all types of automotive components, electrical components, spare parts, products, equipments for all types of two-wheelers, passenger cars, light motor vehicles, multi-utility vehicles, heavy motor vehicles, All Terrain Vehicles (ATVs) and all other types of automobiles.

viii) To carry on the business of manufacturing including production and processing and fabrication and assembling, repairing, alteration, buying, importing, marketing, selling and exporting and otherwise dealing in all kinds of equipments, machinery apparatus, tools, assemblers, spares, components, jigs, dies, utensils, commodities for manufacturing all types of automotive components and equipments.

ix) To carry on the business of manufacturing including production and processing and fabrication and assembling, repairing, alteration, buying, importing, marketing, selling and exporting and otherwise dealing in all types of electrical components for home appliance products.

x) To carry on the business of manufacturing including production and processing and fabrication and assembling, repairing, alteration, buying, importing, marketing, selling and exporting and otherwise dealing in all types of telecommunication components.

xi) To design, develop, manufacture, assemble, install, commission, trade, import, export, and deal in all kinds of industrial automation equipment, control systems, robotics, PLC panels, sensor-based technologies and other automation products used in manufacturing, process industries, and utilities.


xii) To carry on the business of research and development, design, provision of technical assistance and licenses, consulting and otherwise of manufacturing systems including production control and quality control and improvement of production lines relating to above objects.

3. A copy of the draft memorandum and articles of association of the proposed company may be inspected at the office at 731 1 B/30, MADHU NIVAS,ANAND CO. OP HOUSING SOCIETY, COLLEGE ROAD, BILIMORA, NAVSARI, GUJARAT- 396321, INDIA.

4. Notice is hereby given that any person objecting to this application may communicate their objection in writing to the Registrar at Central Registration Center (CRC), Indian Institute of Corporate Affairs (IICA), Plot no. 6, 7, 8, sector 5, IMT Manesar, District Gurgaon (Haryana), pin code 122050, within twenty-one days from the date of publication of this notice, with a copy to the company at its registered office.

Name(s) of Applicant
Dated this 14th Day of November, 2025

1) SHARADKUMAR TULSIDAS PATEL 2) HIRAL PATEL



STYRENIX PERFORMANCE MATERIALS LIMITED
CIN : L25200GJ1973PLC002436

Registered Office : 9th Floor, "Shiva", Sarabhai Complex, Dr. Vikram Sarabhai Marg, Vadiwadi, Vadodara - 390023, Gujarat. **Tel. No. : +91 265 2303201 / 2303202**
Email : secshare@styrenix.com | **Website :** www.styrenix.com

SPECIAL WINDOW FOR RE-LODGEMENT OF TRANSFER REQUESTS OF PHYSICAL SHARES

Notice is hereby given that pursuant to SEBI Circular SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/ 2025/97 dated July 02, 2025, a special window has been opened for a period of 6 months commencing from July 07, 2025 to January 06, 2026 for re-lodgment of transfer deeds, which were originally lodged prior to the deadline of April 01, 2019 and rejected, returned, not attended to due to deficiency in the documents or otherwise missed the extended timeline of March 31, 2021 for re-lodging their documents for transfer of securities.

Investors who have missed the aforementioned timeline for re-lodging their documents for transfer of securities are requested to contact the Company's Registrar and Share Transfer Agent ("RTA"), MUFG Intime India Private Limited (Formerly Link Intime India Private Limited) at their email ID investor.helpdesk@in.mpgms.mufg.com or at their office at "Geetakunj", 1, Bhakti Nagar Society, Behind Abs Tower, Old Padra Road, Vadodara - 390015 or the company at secshare@styrenix.com.

During this period, the securities that are re-lodged for transfer (including those request that are pending with the company / RTA as on date, if any) and being verified by the RTA shall be issued only in Demat Mode. The necessary procedures for transfer cum demat requests will be followed.


For Styrenix Performance Materials Limited

sd/-

Chintan Doshi
Manager Legal & Company Secretary

Place : Vadodara

Date : November 18, 2025



HDFC Bank Ltd.

POSSESSION NOTICE

Branch Address: 201 - 204, Riddhi Shoppers, Opp. Imperial Square, Adajan - Hazira Road, Surat - 395009.

Whereas The Authorised Officer/s of **HDFC Bank Limited** (erstwhile **HDFC Limited** having amalgamated with **HDFC Bank Limited** by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023), (**HDFC**) under Securitization And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amounts mentioned against their respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices, within 60 days from the date of the said Notice/s, incidental expenses, costs, charges etc till the date of payment and /or realization.

Sr. No.	Name Of Borrower (S) / Legal Heir(S) And Legal Representative(S)	Outstanding Dues (Rs.)	Date Of Demand Notice	Date Of Possession Physical/ Symbolic	Description Of Immoveable Property (ies) / Secured Asset (S)
(a)	(b)	(c)	(d)	(e)	(f)
1	MR. UMA SHANKAR GIRI (BORROWER) MRS. MADHURI GIRI (CO-BORROWER) 201395 - 674844792, 673195260	Rs.23,495/- and Rs.5,49,685/- respectively as on 30 June, 2025*	07 Aug., 2025	14 Nov., 2025 SYMBOLIC	FLAT - 507, 5TH FLOOR, FORTUNE - DP - NANO 2 - G, S. NO. 3052/ 3061, 3062/ O P - K R I S H I (AGRICULTURE) FARM, VAPI - KACHIGAM ROAD, DAMAN AND DIU - 396210.
2	Wife/Son/Daughter/Husband of Mr./Mrs./Ms. MAYANK ONKAR SINGH [since deceased] And other known and unknown Legal Heir(s), Successors and Assigns of Mr./Mrs./Ms. MAYANK ONKAR SINGH [since deceased] (BORROWER) 201538 - 636910835, 638666516	Rs.16,64,893/- and Rs.22,163/- respectively as on 30 June, 2025*	07 Aug., 2025	14 Nov., 2025 SYMBOLIC	FLAT - 1002, 10TH FLOOR, ROYAL LAKE CITY - J. S. NO. 70/3P/P2, OPP. DHARTI PETROL PUMP, OPP. AKRA MARUTI TEMPLE, SANJAN - UMBERGAON ROAD, VALSAD - 396170.
3	MR. BIMBADHAR SAHU (BORROWER) MS. ANIMA SAHO (CO-BORROWER) 201505 - 692926881, 702548951, 692849658	Rs.36,527/-, Rs.15,15,361/- and Rs.87,285/- respectively as on 30 June, 2025*	07 Aug., 2025	14 Nov., 2025 SYMBOLIC	FLAT - 510, 5TH FLOOR, MINDTREE GEHANA - B. S. NO. 3421, 3422 (OLD NO. 486 / P / 6 + 7) , NEAR SWAMINARAYAN SCHOOL, VAPI SPORTS CLUB, GURUKUL ROAD, PATEL FALIYA, CHALA, VAPI - 396191.
4	MR. HARISH MANSINGH BHUL (BORROWER) MRS. ANITA LOKBAHADUR BHOLA (CO-BORROWER) 201510 - 690194411, 687642048	Rs.98,911/- and Rs.8,48,132/- respectively as on 30 June, 2025*	06 Aug., 2025	14 Nov., 2025 SYMBOLIC	FLAT - 402, 4TH FLOOR, ALAKHANADA COMPLEX CO. OP. HOUSING SOC. LTD., PLOT - C-18, S. NO. 93/P, OPP. H.P. RETROL PUMP 52 HECTOR CORNER, NEW GIDC , UMBERGAON (WEST), VALSAD - 396170.
5	MR. NITIN CHAMPAKBHAI BAKARANIYA (BORROWER) 201569 - 602127429	Rs.1,43,597/- as on 30 June, 2025*	06 Aug., 2025	14 Nov., 2025 SYMBOLIC	308, POONAM PARK, PLOT NO: 91 & 92, R. S. NO. 113, CHIKUWADI, OPP. VRAJ BHUMI - 2, VAPI - DAMAN ROAD, VAPI- 396191.
6	Ms. KSHITIKA KASHINATH CHAVAN (BORROWER) 201539 - 676514543, 670287416	Rs.1,19,496/- and Rs.25,23,641/- respectively as on 30 June, 2025*	06 Aug., 2025	14 Nov., 2025 SYMBOLIC	FLAT - 403, 4TH FLOOR, APEX LAKEVIEW - A, S. NO. 1154 (OLD NO. 62/A/P2), NEAR AKRA MARUTI TEMPLE, OPP. AKRA LAKE, UMBERGAON - SANJAN ROAD , UMBERGAON (WEST), VALSAD - 396170.
7	MR. RANJAN PRAKASH SRIVASTAVA (BORROWER) 201571-604566604	Rs.1,52,936/- as on 30 June, 2025*	07 Aug., 2025	14 Nov., 2025 SYMBOLIC	4 0 7 , S H R E E J I APPARTEMENT, PLOT NO. 43 TO 50, CHIKUWADI, CHALA, VAPI- 396191.
8	MR. PANKAJ C. SINGH (BORROWER) 201572 - 604770412, 612981064	Rs.2,01,397/- and Rs.0/- respectively as on 30 June, 2025*	07 Aug., 2025	14 Nov., 2025 SYMBOLIC	401, SUN RESIDENCY - E, PLOT - B, S. NO. 194/2, OPP. ROYAL GARDEN, DAMAN - CHALA ROAD, VAPI - 396191.
9	Mr. PRAVIN SHIVSARAN KOLI (BORROWER) Mrs. SANGITABEN SHIVCHARAN KOLI (CO-BORROWER) 196790 - 683060976, 6536808				

